



KEMISTAR CORPORATION LTD.

CIN No. : L24233GJ1994PLCO22845

604, Manas Complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015,
Gujarat, India. **Ph** : 079-26923570 / 26923587 **Email** : kemistarbse@gmail.com

February 05, 2020

To,
BSE Limited,
Listing Dept. /Dept. of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Dear Sir/ Madam,

Subject: Submission of Newspaper Clipping

Ref.: Regulation 47 (1) (a) of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015

Scrip code: 531163

Security ID: KEMISTAR

Please find enclosed herewith Newspaper Clipping of the Notice of Board Meeting as per Regulation 47 (1) (a) of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015 for approval of unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended on December 31, 2019 published in Newspaper on Wednesday, February 05, 2020 for your records.

Kindly acknowledge the receipt of the same.

Thanking You,

For, Kemistar Corporation Limited



Ketankumar Patel
Managing Director
(DIN 01157786)

RAJKOT INVESTMENT TRUST LTD.
(CIN: L65910G1982PLC005301)
B-16, Second Floor, Kalyan Building, Kuvadva Road,
Rajkot, Gujarat-360001
Email: rajkotittd@gmail.com

NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of RAJKOT INVESTMENT TRUST LIMITED will be held on Friday, 14th February 2020 at the Corporate Office of the Company at H-54, 1st Floor, Trade Center, 16, South Takraji, Indore-492001 to consider and approve inter unaudited quarterly results for quarter ended December 31, 2019, and to transact the other businesses mentioned in the Board Meeting Notice.

The said notice is also available on the website of the Company at www.rkt.co.in and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.bseindia.com.

By Order of the Board
Rupesh Jain
Managing Director
(DIN: 06836912)

AMBITIOUS PLASTOMAC COMPANY LIMITED
(CIN: L25200G1992PLC107000)
405 Royal Square, Nr. JBR Arcade, Science City Road, Sola,
Ahmedabad-380015
Email: ambitiousplast@gmail.com

NOTICE
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of AMBITIOUS PLASTOMAC COMPANY LIMITED will be held on Thursday, 13th February 2020 at the Registered Office of the Company at 405 Royal Square, Nr. JBR Arcade, Science City Road, Sola, Ahmedabad 380015 to consider and approve inter unaudited quarterly results for quarter ended December 31, 2019, and to transact the other businesses mentioned in the Board Meeting Notice.

The said notice is also available on the website of the Company at www.ambitiousplastomac.com and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.bseindia.com.

By Order of the Board
Sd/-
PINKAL PATEL
Managing Director
(DIN: 06512030)

ZEAL AQUA LIMITED
(CIN: L0504G2009PLC056270)
Registered Office: At Olpad GIDC Pl. No. 4, 5, Ta Olpad,
Surat 394540, Gujarat
Tel.: +02621-220047; Email: zealacqua@gmail.com;
Website: www.zealacqua.com

Notice of Board Meeting
Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Meeting of the Board of Directors is scheduled to be held on Friday, 14th Day of February, 2020 at 4:00 P.M. at the registered office of the Company situated at Olpad GIDC Pl. No. 4, 5, Ta Olpad, Surat 394540, Gujarat, inter alia, to consider and approve Unaudited Standalone Financial Results for the quarter and nine months ended December 31, 2019.

The said information is also available on the Company's website at www.zealacqua.com and on the website of the stock exchange at www.bseindia.com.

For Zeal Aqua Limited
Sd/-
Khashubho Vaishnav
(Company Secretary & Compliance Officer)

WESTERN RAILWAY - RAJKOT DIVISION
VARIOUS ENGINEERING WORKS

Sr. No.	Tender No.	Name of work	Approximate NIT Cost (₹)	EMD Cost (₹)	Date: 29-01-2020
1	DMR-RJT/19-8-2020	Rajkot Division - Construction of 19.8-2020 unspecified line and receiving line	56,75,325.80	1,08,30,000	15.00/16.00 hrs
2	DMR-RJT/19-8-2020	Execution of various track works under Divisional Engineer (Works)	39,48,694.85	73,00,000	15.00/16.00 hrs
3	DMR-RJT/19-8-2020	Outsourcing of track maintenance activities under Senior Section Engineer (P-Way) M/s's section.	69,82,081.48	1,38,30,000	15.00 hrs

Address of the Office & Website particulars: Divisional Railway Engineer (Engineering), Western Railway, Kutch Compound, Rajkot-360 001. Website: www.westernrail.in

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION
TENDER NOTICE FOR PROVISION OF CATERING SERVICES

Sr. No.	BID No.	Station & Int. No.	Location	Reserve price per annum	EMD
1	CAS/PTN-3/GMU/2019-20	PTN No. 1	Office towards Mahatma	₹ 5,26,000/- for 1st three Year + GST applicable	₹ 55,000/-
2	CAS/GMU/2019-20	Sidhpur	Covered	₹ 1,63,000/- for 1st three Year + GST applicable	₹ 6,900/-
3	CAS/Tender MS-1/AJE/19-20	Angar	New Station	₹ 1,84,000/- for 1st three Year + GST applicable	₹ 8,900/-
4	CAS/Tender MS-1/LJA/19-20	Linja	Water Hut	₹ 1,45,000/- for 1st three Year + GST applicable	₹ 4,700/-
5	CAS/Tender MS-1/PTN-3/20-20R1	PTN No. 1	FOB KAC	₹ 1,14,13,850/- for 1st three Year + GST applicable	₹ 11,30,000/-
6	CAS/Tender MS-1/SBB/19-20R1	Sabamati	FOB No. 6 & 7 towards Mahatma	₹ 1,14,13,850/- for 1st three Year + GST applicable	₹ 11,30,000/-

Reserve for For Sr. No. 1, 2, 4, 5 & 6: General For Sr. No. 2, GMU (Women) Tender Form Fee: ₹ 5,000/- Date and Time of Closing of Tender and Opening of Tender: Up to 15:00 hrs. on 08-03-2020 and on 10:30 hrs. on 08-03-2020. Address for Communication: Office of Divisional Railway Manager (Commercial), Ahmedabad Division, Western Railway, Nr. Chhatrapati Mhatra, Navroji Road, P.O. Solapur, Ahmedabad-382345. Website: www.westernrailways.in

Neighbour blackmails, rapes woman in Aslali

AHMEDABAD: A 25-year-old woman, a resident of Indiranagar near Aslali, on Sunday filed a complaint with the Ahmedabad rural police alleging that her neighbour raped her and threatened to kill her and her husband if she told anyone about the assault.

In her FIR with Aslali police, the woman, who is from Agra, said that her neighbour, Sandip Devagar, shot objectionable pictures of her, blackmailed her and then raped her on October 9.

He had threatened to kill her and her husband if she spoke about the incident and did not meet his demands.

"As Devagar was our neighbour, he would frequent our house when my husband was at work. During one such visit, he shot compromising pictures and videos of me without my knowledge. He then began blackmailing me

SUNGOLD CAPITAL LTD
(CIN: L65910G1993PLC018956)
Regd. Off: House No. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpilla, Narmada - 393145.
Corporate Off: B/6/18, 6th Floor, Jewaswani allied Business Centre, Off. Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064.
Tel no: 022-28891692, 08108756812
Website: www.sungoldcapitallimited.com
Email: info@sungoldcapitallimited.com

NOTICE
NOTICE is hereby given that pursuant to regulation 47 read with Regulation 29 & 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company will be held on Thursday 13th February 2020 at the Corporate office of the Company inter alia, to consider and approve the Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2019.

For Sungold Capital Ltd
Sd/-
CS Versha Chaturani
Company Secretary & Compliance Officer
Membership No: 59225

BHARAT CO-OP. BANK (MUMBAI) LTD.
(MULTI-STATE SCHEDULED BANK)
Central Office: "Masthead", Plot No. 139A, Sarvesh Road, Gopuram Estate, Mumbai - 400055. Tel: 8189 0989 / 6189 0134

PUBLIC NOTICE U/S. 13(4) OF SARFAESI ACT, 2002

Whereas, NOTICE is hereby given that the following Borrowers have failed and avoided to repay loan installments to Bharat Co-operative Bank (Mumbai) Ltd. as per the Demand Notice dated 22.08.2019 under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (the SARFAESI Act), hereby calling upon the Borrowers to repay the total aggregate loan liability.

Since, you have failed and neglected to discharge your liability within 60 days of publication of notice under Section 13(2) of SARFAESI Act, 2002, you are once again called upon to discharge your liability under Section 13(4) of the said Act, to discharge your liabilities on or before 12.02.2020 or hand over the possession of the mortgaged property situated in the table herein on or before 12.02.2020 or 12.30 p.m. or soon thereafter.

The Borrowers are requested to remain present to handover the vacant and peaceful possession of the following mortgaged property to the Authorized Officer for the sale date and time taking which the Authorized Officer shall be constrained to take over the possession of the mortgaged premises in your absence and proceed further in the matter which you please take note of.

In the meantime, the Borrowers in particular and public in general are hereby cautioned not to deal with below mentioned mortgaged property without the consent of the bank.

Borrowers/JoinCo-Borrowers & Surety	Notice Amount	Property Mortgaged
1. Ms. Divya Jyoti Agri & Infra Projects LLP (B-602, Shreejagat Society, Chokewada, Taksa Garden, Navsari, Gujarat - 396380.) (H) Shop No. T/02, 3rd Floor, "Harkrishna Plaza", S. No. 183/A and 183/B/1, further interest of 13.80% per annum + penal interest of 2% per annum thereon w.e.f. 01.11.2011 to 01.08.2019.	Term Loan Account No. 081133518400856329 sq. ft. carpet area, i.e. Rs. 60,86,414/- as on 20.08.2019 together with further interest of 13.80% per annum + penal interest of 2% per annum thereon w.e.f. 01.11.2011 to 01.08.2019.	Shop No. T-02, adjoining No. 1113, 60 sq. ft. built up area alongwith right to use 1/3rd portion situated on the Third Floor of the Building known as "Harkrishna Plaza" (constituted on land bearing Survey No. 183/A and 183/B/1, situated at Post Office: Hinawadi, Opp. Mhambai Bus Stop, Panchsarovar, Navsari - 422003.
2. Mr. Vinod Sahebrao Raza (22A, Shivraj Society, Near Dnyesh Vidhyahar School, Eroo, Chhatra Rasta, Vileparle, Navsari, Gujarat - 396450.)		22A, Shivraj Society, Near Dnyesh Vidhyahar School, Eroo, Chhatra Rasta, Vileparle, Navsari, Gujarat - 396450.
3. Mr. Anil Naginbhai Patel (145, Khatra, Al-Past Darni, Dadra, Dadra & Nagar Haveli - 396183.)		145, Khatra, Al-Past Darni, Dadra, Dadra & Nagar Haveli - 396183.
4. Mr. Dharmesh Subhash Dabhadre A-48, Ratheshyam Nagar Society, Opp. K.P. Park Society, Eroo, Navsari, Gujarat - 396450.		Opp. K.P. Park Society, Eroo, Navsari, Gujarat - 396450.
5. Mr. Dharmesh Dayabhai Solanki Kumbharwad, Near Hanuman Temple, Al Post Kojari, Takli Pardi, Navsari, Gujarat - 396191.		Al Post Kojari, Takli Pardi, Navsari, Gujarat - 396191.
6. Mr. Jayesh Vansha Pawar 228, Khalepada, Khatra, Khambel, Silvassa, Dadra & Nagar Haveli - 396230. (Mashik Branch)		228, Khalepada, Khatra, Khambel, Silvassa, Dadra & Nagar Haveli - 396230.

Date: 31.01.2020
Place: Mumbai
Sd/-
Pravin Kumar S. Suvarna (Asst. General Manager)

SAGARDEEP ALLOYS LIMITED
(CIN: L25200G2009PLC056001)
Regd. Office: PLOT No. 2079, RAJNAGAR PATYA, SANTEJ KHATRA ROAD, SANTEJ KALDI Gandhinagar GIDC 382211 (N)
E-mail id: info@sagardeep.com website: www.sagardeep.com
Contact No: 02764281297

Extract of Un-Audited Standalone Financial Results for the Quarter ended 31st December, 2019

Particulars	Quarter Ended		
	31-12-2019 (Unaudited)	31-12-2018 (Unaudited)	31-03-2019 (Audited)
Total Income from Operations (net)	728.83	1246.95	5187.25
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	6.69	(10.80)	233.92
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	6.69	(10.80)	233.92
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	5.57	20.39	172.96
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	5.57	20.39	172.96
Equity Share Capital	1137.16	1137.16	1137.16
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	1473.78	1473.78	1473.78
Earnings Per Share (₹/-) 10/- each (for continuing and discontinued operations)	0.05	0.18	1.52
Basic	0.05	0.18	1.52
Diluted	0.05	0.18	1.52

Extract of Un-Audited Consolidate Financial Results for the Quarter ended 31st December, 2019

Particulars	Quarter Ended		
	31-12-2019 (Unaudited)	30-09-2019 (Unaudited)	30-09-2019 (Audited)
Total Income from Operations (net)	731.95	890.78	5275.71
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	7.70	4.71	331.77
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	7.70	4.71	331.77
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	3.06	5.86	368.84
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	3.06	5.86	368.84
Equity Share Capital	1073.83	1073.83	1073.83
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	1464.55	1464.55	1464.55
Earnings Per Share (₹/-) 10/- each (for continuing and discontinued operations)	0.03	0.05	3.57
Basic	0.03	0.05	3.57
Diluted	0.03	0.05	3.57

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.sagardeep.com) and on the website of NSE Ltd (www.nseindia.com).
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote."
3. Exceptional and/or Extraordinary Items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS / IAS Rules, whichever is applicable.

For and on behalf of Board
For, SAGARDEEP ALLOYS LIMITED
Sd/-
SATISHKUMAR ASANAL MEHTA
Managing Director
(DIN: 01958984)
Date: 03/02/2020
Place: Santej (Kalo)

WESTERN RAILWAY
TRANSPORTATION OF 20 NOS. LOCOMOTIVE BODIES IN 10 ROUND TRIP

Tender No. 02-2020. Date: 03/02/2020.
Tender Notice No. M2331A/E/Tender/2/2019-2016. Loca. Begonia, Divisional Railway Manager (Mechanical), Western Railway, Bhavnagar. Para invites a tender on behalf of President Union of India in prescribed form for the following work:
Name of work and its location: Transportation of 20 Nos. Locomotive Bodies in 10 round trip from Anelli Station to Diesel Shed Sabamati and back on vice a versa by road trailers for one year. i.e. 12 Months. Estimated Cost for Work Approx: ₹ 7,78,793/- (Seven Lakh Seventy Six Thousand Seven Hundred Ninety Three Only).
Executing GST / Completion Period: One Year (i.e. 12 Months). The bidders have to apply online through link i.e. www.mepco.gov.in only for further details. Please visit website www.mepco.gov.in Last date for online apply 03/02/2020 up to 15:00 hrs.

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION
COMPREHENSIVE ANNUAL MAINTENANCE CONTRACT OF DATA LOGGERS

The Divisional Railway Manager (S&T) Western Railway, Bhavnagar invites tenders on behalf of President of India for the following work:
(1) Name of Work: Bhavnagar Division Comprehensive Annual maintenance contract of Data loggers (ETB) works on Bhavnagar Para, for three years (2) Estimated Cost: ₹ 34,60,026/-. The bidders have to apply on the tender link i.e. www.mepco.gov.in only. For further details, please visit website www.mepco.gov.in. Last date for online apply 03-02-2020 up to 15:00 hrs.

Nandini Texcom (India) Limited
B-304, International Commerce Center, Near Kadivala School, Ring Road, Surat - 395002
Phone : 0261-4004596, Email : nandintexcom@hotmail.com
CIN : L65910G1994PLC021105 www.nandintex.com

Notice
Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company (vide serial no. NTIL/DM/24/19-20/5) is scheduled to be held on Tuesday, the 11th Day of February, 2020 at 5.00 P.M. at registered office of the Company B-304, International Commerce Center, Near Kadivala School, Ring Road, Surat - 395002 IN, Gujarat.
To consider and inter alia to approve the quarterly unaudited Result and limited review reports of the Company for the quarter ended on 31.12.2019 and any other matter with the permission of chair.
Sd/-
For, on behalf of the board
ASHOKKUMAR R. TEKKIRVAL
(Managing Director)

KEMISTAR CORPORATION LIMITED
(CIN: L2423G1994PLC022845)
Registered Office: 604, Manas Complex, Near Jodhpur Cross Road Satellite, Ahmedabad Gujarat - 380015.
Email: kemistartse@rediffmail.com Web: www.kemistar.in

NOTICE
Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Meeting of the Board of Directors of the Company will be held on Friday, February 14, 2020 at the registered office of the Company, inter alia, to consider & approve the Consolidated and Standalone unaudited Financial Results for the quarter ended on December 31, 2019.

The information contained in this notice is also available on the company's website at www.kemistar.in and on the website of Bombay Stock Exchange at www.bseindia.com.

FOR KEMISTAR CORPORATION LIMITED
Date : February 04, 2020
Place: Ahmedabad
Kantakumar Patel
Managing Director
(DIN 1157786)

Unjha Formulations Limited
REGD. OFFICE : KHALI CHAR RASTA, STATE HIGHWAY, SIDHPUR -384 151

STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31/12/2019

Sr	Particulars	RS. in Lacs		
		31.12.2019 Unaudited	31.12.2018 Unaudited	31.03.2019 Audited
1	Total Income from Operations	227.53	211.79	1152.37
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	1.72	-4.23	30.03
3	Net Profit / (Loss) for the period (before Tax, after Exceptional and/or Extraordinary Items)	1.72	-4.23	30.03
4	Net Profit / (Loss) for the period (after Tax, after Exceptional and/or Extraordinary Items)	1.72	-4.23	30.03
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	1.72	-4.23	30.03
6	Equity Share Capital	448.05	448.05	448.05
7	Reserve (excluding Revaluation Reserve) as shown in the In the Audited Balance Sheet of previous year	19.50	19.50	19.50
8	Earnings Per Share (₹/- 10 each) for continuing and discontinued operations	0.03	-0.09	0.67
1	Basic	0.03	-0.09	0.67
2	Diluted	0.03	-0.09	0.67

NOTES
1. The above results have been reviewed by Statutory Auditors and recommended by the Audit committee and approved by Board of Directors meeting held on 04.02.2020
2. Figure of previous year / period are regrouped wherever necessary.
3. There being only one segment of business, above represents figures of one segment.
4. The Company has no pending investor's complaints at the beginning and close of the quarter.
5. Reconciliation between financial results under India GAAP and IAS for the Nine Month, ended on 31st December, 2019 of 2019-20 is as under:

Particulars	Three months ended 31st 31.12.2019	Three months ended 30th September 30.09.2019
Net Profit/Loss after tax under previous GAAP	1.72	24.58
Add/Less: Adjustments for GAAP differences	---	---
a. Other Comprehensive Income	---	---
b. Deferred Tax on adjustment	---	---
Net Profit/Loss after tax as per Ind-AS	1.72	24.58

Place: Sidhpur
Date : 04.02.2020
CIN No. : L8999G1994PLC022932
Ganpat Prajapati
CFO
For UNJHA FORMULATIONS LIMITED
Mayank S. Patel
Managing Director

TEXEL INDUSTRIES LIMITED
Regd. Office: Block No. 2106, Santej Khatri Road, Nr. Shah Alloy Ltd., Vile-Santej, Tal. Kalo, Dist. Gandhinagar - 382 721, Gujarat, India
CIN: L25200G1989PLC022576; Ph: 9198902622/26110; Email: finance@texel.com; Website: www.texel.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2019

Sr.No.	Particulars	Consolidated (₹. in Lakhs except EPS)			
		Quarter Ended: 31-12-2019 (Unaudited)	Nine Months Ended: 31-12-2019 (Unaudited)	Quarter Ended: 31-12-2018 (Unaudited)	Quarter Ended: 31-12-2018 (Unaudited)
1	Total Income from Operations	1848.12	7586.72	2373.31	2373.31
2	Net Profit/(Loss) for the period before tax (before Exceptional and/or Extraordinary Items)	23.49	265.90	37.28	37.28
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	23.49	265.90	37.09	37.09
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	11.52	173.01	11.45	11.45
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	11.52	173.01	11.45	11.45
6	Paid up Equity Share Capital (Face value of Rs. 10 each)	522.29	522.29	522.29	522.29
7	Other Equity	---	---	---	---
8	Earnings per share of Rs. 10/- each (for continuing and discontinued operations)	31.39	241.92	23.61	23.61
1	Basic	0.22	3.31	0.22	0.22
2	Diluted	0.22	3.31	0.22	0.22

Notes:
1. Additional information on Standalone Financial Results is as follows:

Particulars	Quarter Ended			
	31-12-2019 (Unaudited)	31-12-2019 (Unaudited)	31-12-2018 (Unaudited)	31-12-2018 (Unaudited)
Income from Operations	1848.12	7586.72	2373.31	2373.31
Profit Before Tax	43.34	334.81	49.55	49.55
Profit After Tax	31.39	241.92	23.61	23.61
Total Comprehensive Income (After Tax)	31.39	241.92	23.61	23.61

2. The above is an extract of the detailed format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and nine months ended 31st December, 2019 filed with the Bombay Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and nine months ended 31st December,

